

RP WEB SOLUTIONS
Website For Everyone...

Ronak Palan
Web Consultant

+91 84888 55506

rpwebsolutions2020@gmail.com

(ટેક્સ સંલગ્ન તથા અન્ય મહત્વના સમાચાર પ્રસિદ્ધ કરવું માસિક)

ટેક્સ ટુડે

RNI No.GUJGUJ/2016/74805

Tax Today (Monthly)

કરવેરા સલાહકાર

સીધા અને આડકતરા કરવેરાની સાદી અને સરળ ભાષામાં માહિતી આપતું ગુજરાતી પબ્લિકેશન

વાર્ષિક લવાજમ :- ૩૬૯૫

સંપર્ક:-
પૂજા પબ્લિકેશન
મનિષ શાહ
૯૯૨૪૧ ૧૬૩૯૯

Post. Regn. No. G-JND/338/2020-2022. - Office of posting Una Post Office on 3 rd Monday of Every Month		પ્રતિશ્રી,	
◆ વર્ષ: ૯, ◆ અંક: ૦૮, ◆ સળંગ અંક: ૧૦૩, ◆ તા.૨૧/૦૬/૨૦૨૫, શનિવાર, ◆ પાના-૪, ◆ છૂટક અંકની કિંમત રૂ.૨૦, ◆ વાર્ષિક લવાજમ રૂ.૨૦૦/- (કુરીયર સાથે રૂ.૩૦૦/-)	◆ તંત્રી-માસિક અને પ્રકાશક: ભવ્ય ટિપ્પકભાઈ પોપટ, ◆ પ્રકાશન સ્થળ: ૨૦૨-૨૦૩, ધ્રુવ કોમ્પ્લેક્સ, પોલીસ લાઈન સામે, ઉના, જી.ગીર સોમનાથ-૩૬૨૫૬૦		
◆ ફોન : ૦૨૮૭૫-૨૨૧૭૦૦, ફેક્સ : ૦૨૮૭૫-૨૨૧૭૦૦, મો. : ૯૯૨૪૧ ૨૧૭૦૦	◆ મુદ્રણ સ્થળ : પ્રથમેશ ઓફસેટ, ગોદરા ચોક, ઉના		
e-mail: taxtodayuna@gmail.com ◆ e-mail: editor@taxtoday.co.in ◆ www.taxtoday.co.in			

ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત ૧૫ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી

૩૧ જુલાઈ એ ભરવાં પાત્ર રિટર્નની મુદત ૧૫ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી

તા. ૨૭.૦૫.૨૦૨૫ ઈન્કમ ટેક્સ કાયદા હેઠળ ઓફિસ કરવાના જવાબદારી ના હોય તેવા કરદાતાઓ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત જેને નાણાકીય વર્ષ પૂર્ણ થયા પછીની ૩૧ જુલાઈ રહેતી હોય છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આ કરદાતાઓ માટે મુદતમાં વધારો કરી રિટર્ન ભરવાનો સમય ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી કરી આપવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ હેઠળ TDS ના રિટર્નની ડિલિટ ફોર્મ 26ASમાં ૩૧ મે પછી જ દેખાતી હોય છે. ઈન્કમ ટેક્સની રિટર્ન



(CBDT) દ્વારા ૨૭ મે ના રોજ પ્રેસ વિબ્રેશન બહાર પાડી આ મુદત વધારી આપવા અંગે જાહેરાત કરી આપી છે. CBDT દ્વારા પ્રેસ રીલીઝ માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વધારા ના કારણે કરદાતાઓને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં પૂરો સમય મળી રહે તે માટે આ વધારો કરવામાં આવ્યો છે. CBDT દ્વારા ખૂબ સમયસર જાહેર કરવામાં આવેલા આ વધારોને કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ તરફથી સકારાત્મક આવકાર મળ્યો તે ચોક્કસ છે.

ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

જૂના-નવા મોબાઈલ ખરીદ-વેચાણ કરનાર વેપારીઓએ આધાર-પૂરાવાનું રજિસ્ટર નિભાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ

તા. ૧૮.૦૬.૨૦૨૫ ગીર સોમનાથ જિલ્લામાં બનતા ગુનહાઓમાં વપરાતા મોબાઈલ તેમજ મોબાઈલ ચોરીના ગુનહાઓમાં જૂના મોબાઈલ ખરીદ/વેચાણ કરના વેપારીઓ તરફથી આવા મોબાઈલ ખરીદતા/વેચતા વ્યક્તિની માહિતી મળી રહે તેમજ ગુનહાઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને પકડી શકાય અને આવા ગુનહાઓ નિવારી શકાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જૂના કે નવા મોબાઈલ લે-વેચ કરનાર વેપારીએ કોઈપણ વ્યક્તિઓની પૂરતી ખરાઈ ઓળખાઈ અથવા ઓળખપત્ર વગર જૂના મોબાઈલની લે-વેચ કરી શકશે નહીં તેમજ જૂના-નવા મોબાઈલ ખરીદતી કે વેચતી વખતે નિયત નમુનાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે.

આ રજિસ્ટરમાં મોબાઈલ ફોનની વિગત/ક પત્રી/મોડેલ નંબર, આઈ.એમ.ઈ.આઈ નંબર, મોબાઈલ ફોન ફોની પાસેથી ખરીદ કરેલ છે/વેચેલો છે, તેનું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર સહિત

ઓળખાઈની વિગતો સહિત આધાર-પૂરાવાની નોંધ કરવાની રહેશે. આ જાહેરનામું તા. ૨૦-૦૬-૨૦૨૫થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિખાને પાત્ર કરશે.આ જાહેરનામું ગિર-સોમનાથ જિલ્લા માટે બહાર પાડવામાં આવ્યું છે પરંતુ જૂના મોબાઈલની ખરીદ વેચાણ કરનાર દરેક વેપારી આ બાબતની તકેદારી રાખવી જોઈશે તેનું કાયદાકીય નિષ્પાત્તો માની રહ્યા છે.

ભ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે



કવિ અને સાહિત્યકારોની નગરી પાલનપુર ખાતે વહેલી સવારે શૈક્ષણિક સેમિનાર યોજાયો

પાલનપુર, તા. ૧૪ જૂન ૨૦૨૫

ગુજરાતમાં ટેક્સ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લાના પાલનપુર ખાતે “પ્રથમ મોડેલિંગ સેમિનાર”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનું આયોજન All Gujarat Federation of Tax Consultants અને તેના સંયુક્ત સહયોગીઓ જેમ કે B.K. District Tax Practitioners Association, The Gujarat State Tax Bar Association, Banaskantha District Chamber of Commerce and Industry, Rotary Club of Palanpur City, Lions Club of Palanpur, s/p Palanpur Banaskantha CPE Study Chapter of WIRC of ICAI દ્વારા હાથ ધરવાનું હતું. કુલ સાત સંસ્થા પરસ્પર એક સાથે જોડાઈ અને ઉમદા કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું આ બંને એક એકાદિગતિક ઘટના બની રહી જાનના આ મહાપ્રયત્નમાં અમને પ્રત્યક્ષ સાક્ષી બનવાનો અવસર મળ્યો એ બાબતનું અમને ગૌરવ છે.

કવિ અને સાહિત્યકારો નગરી પાલનપુર ખાતે વહેલી સવારે “હોટેલ ધ ગ્રાન્ડ રિઝોર્ટ (TGR), આયુ હાઉસ, પાલનપુર”, કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી, જ્યાં સવારે ૮.૧૫ વાગે રજિસ્ટ્રેશન શરૂ થયું હતું અને સવારનો હળવો ચા-નાસ્તો કરી અને ૯.૩૦ વાગે કાર્યક્રમની ઓપરારિક શરૂઆત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ખાસ આમંત્રણ હેઠળ બે નિષ્પાત્તો દ્વારા ત્યાગના આપવામાં આવ્યું. CA MEHUL THAKKER - જેમણે ITR Forms AY 2025-26માં થયેલા ફેરફારો, ૧ એપ્રિલ ૨૦૨૪થી અમલમાં આવેલા નોન કોર્પોરેટ એકમો માટેના નાણાકીય રિપોર્ટિંગના નવા માળખા અને બજેટ ૨૦૨૫માં કરવામાં આવેલા મહત્વના સુધારાઓ ઉપર વિસ્તૃત વાત કરી. અને ADV. (CA) ABHAY DESAI - જેમણે GST ક્ષેત્રમાં આવેલ તાજા સુધારા વિષે માહિતગાર કર્યા અને જીએસટીના કાયદામાં તાજેતરમાં



સેમિનારમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ખુબજ મોટી સંખ્યામાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, વકીલ, ટેક્સ પ્રોફેશનલ્સ અને વ્યાપારી વર્ગે ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમનું સંચાલન અત્યંત વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું અને સરોના અને પ્રશ્નોત્તરીનો પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના સફળ આયોજન માટે M.B. Shah Foundation અને Team Fortune Makers દ્વારા ખાસ સહયોગ આપવામાં આવ્યો હતો.

અતે તમામ ઉપસ્થિત સભ્યોને મોમેન્ટો અને ટ્રોફી અને સંમાનપત્ર અપીને સન્માનિત કરવામાં આવ્યા અને ઉપસ્થિત મહેમાનો તથા આયોજકોનો આભાર માનવામાં આવ્યો.

ટેક્સ-રિપોર્ટર - હર્ષદ ઓઝા (સમગ્ર ઉત્તર ગુજરાત ઝોન)
www.harshadokumar.v.co.za.wordpress.com

ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાતના વર્ષ ૨૫-૨૬ના હોદ્દેદારો નિમાયા

તા. ૧૫.૦૬.૨૦૨૫- ગુજરાતનું નામાંકિત એકમાત્ર સ્પેશિયલ ટેક્સ એડવોકેટ વ્યવસાયીઓનું એસોસિએશન ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાત અમદાવાદની તા. ૧૪/૬/૨૦૨૫ના રોજ ૫૧મી વાર્ષિક સાધારણ સભા હોટલ રિવેરા સોલર પ્રોટીકો, અમદાવાદ ખાતે મળી જેમાં ઈન્ચાર્જ ઈલેક્શન સુટિનાઈઝર વારીશ ઈશાની એ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઈજીએમમાં સર્વાનુમતે નિયુક્ત થયેલ હોદ્દેદારોના નામ જાહેર કર્યા જેમાં પ્રમુખશ્રી - અનિલભાઈ



દીપગિયા, વાર્ડન પ્રેસિડેન્ટ- બિન્દેશ શાહ, આઈપીપી-જયદીપ પટેલ, મંત્રી-દીપ પરીખ, સહ મંત્રી ગોંગોંગ વ્યાસ, ખજાનચી અમિત સોની, કારોબારી સભ્યો માં અનિલ પરીખ, વસંત પટેલ, પિનાકીન પટેલ, ઉત્સવ પટેલ, મુકેશ વાટાલિયા, પ્રિતેશ ગાંધી, હિતેશ નિમાવતની નિયુક્તિ કરવામાં આવી.

ભ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

CA આણંદ અને વડોદરા બ્રાન્ચ દ્વારા આણંદ મુકામે ‘જ્ઞાન સંગમ’ પરિસંવાદ યોજાયો..

વેસ્ટર્ન રેજિયનના કોષાધ્યક્ષ CA ફેનિલ શાહ તથા વેસ્ટર્ન રેજિયનના સભ્ય CA રીકીન પટેલ એ સવિશેષ હાજરી આપી હતી.

સીએ ઈન્સ્ટીટ્યૂટ (ICAI)ની આણંદ બ્રાન્ચ પ્રમુખ CA રોનક ગોયલએ જણાવ્યું હતું કે આવા આયોજનો આપણા દેશના વિકાસ માટે અતિવાજર્ય છે તેમજ મોટી સંખ્યામાં CA સભ્યોની હાજરી બદલ ખુશી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમની સફળતા બદલ સેક્રેટરી CA જાગૃત શાહ દ્વારા સી કોર્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અમિતભાઈ સોની, ટેક્સ ટુડે, નડિયાદ



Best resort for Corporate events, Staff Tours etc. nr Diu

Flamingo Club & Resort

Why Flamingo is best for Corporate events??

- Nearly 40% of cost then similar hotels of Diu.
- 12% GST Credit available as situated in Gujarat.
- Facilities of Banquets and Party lawns.
- Special Suite rooms for top management.
- Best resort for family and group entertainment
- Pure Veg Restaurant
- Best in class amenities
- Water Sports facility support
- No burden of Liquor on corporates.

Amenities

- Swimming pool
- Mini Theatre*
- Gym & Indoor Sports
- Party Lawn
- Banquet
- Children Play Area

Contact: 9737021700 GM / 9624121700 Front Desk
e mail: contact@flamingoclubresort.com, www.flamingoclubresort.com
Delwada Diu Road, Naliya Mandvi Ta Una. 362520



સ્ટેચ્યુ ઓફ યુનિટી

વેસ્ટમાંથી બેસ્ટનું ઉત્તમ ઉદાહરણ



રાખવામાં આવેલ છે. મને એવી માહિતી આપવામાં આવી હતી કે હેલિપેડ ગ્રાઉન્ડથી આ શો જોવાની વધુ મજા આવે છે એટલે અમે ત્યાં જઈ આ શો જોયો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમય સવારે ૦૮ કલાકથી સાંજે ૦૬ કલાક સુધીનો હોય છે એ મહત્વની બાબત જાણવી જરૂરી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામાન્ય ટિકિટ વર્કસ માટે ૫૩૦ અને બાળકો માટે ૩૨૦ છે. પરંતુ આમાં એક



જાન સફારીની ફી વર્કસ માટે ૨૦૦ રૂ અને બાળકો માટે ૧૨૦ રૂ નો છે. કોઈ ડિજિટલ કેમરા, DSLR કેમરા લઈ ને જવાનું થયું હોય તો તેના મને અલગથી ફી ચૂકવવાની રહે છે. જો કે પ્રવાસીઓ મોબાઈલ દ્વારા આ ફોટોગ્રાફી કરી શકે છે જેની કોઈ ફી નથી ચૂકવવાની રહેતી. જાન સફારી એ એકતાનગરનું સૌથી મહત્વનું આકર્ષણ હોય કોઈ પણ કરણે આ જુદામાં ના આવે તે જરૂરી છે.

૬. નર્મદા આરતી

પોર્ટના ધામ પણ પોતાના ફરવાના સ્થળના લિસ્ટમાં રાખવું જોઈએ. આ જગ્યા મૂળતઃ એક મંદિર છે પણ આ મંદિર ખૂબ સુંદર રીતે બનાવવામાં આવેલ છે. આ મંદિરની આજુ બાજુ ધાર્મિક પ્રદર્શન પણ ખૂબ સરસ છે. આ મંદિરની સવાર સાંજની આરતી પણ પ્રખ્યાત છે. આ મંદિર અને તેની આસપાસની જગ્યા માણવા ત્યાં એક રાત્રિનો મુકામ કરવામાં આવે તો સાચું રહે. જો કે અમરી પાસે આ અંગેનું

એપ્રિલ ૨૦૨૫ ગુજરાતના એક સૌથી મહત્વના અને જાણીતા ફરવાના સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એટલે કે SOU ને ગણી શકાય. આ વર્ષે પરિવાર સાથે વેકેશનમાં SOU જવાનું નક્કી થયું. ૨૦૧૮ થી ખુલ્લું મુકાબેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના સૌથી મહત્વના પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત થયેલ હોય આમ છતાં મારા જેવો પ્રવાસનો શોખીન આઠ વર્ષ સુધી SOU ની વિઝિટ કરી શક્યો ના હતો તેનો હંમેશા વિચાર આવતો હતો. જ્યારે મારી ડિક્ઝીએ મને જણાવ્યું કે તેના “બેસ્ટ લિસ્ટ” માં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યારે તો બાળનું હતું અને વેબને કહ્યું જેવી રીતે થઈ. સામાન્ય રીતે હું પોતે પબ્લિક ટ્રાવેલ દ્વારા એટલે કે ટ્રેન, બસ કે પ્લેન દ્વારા ફાવેલ કરવાનું પસંદ કરું છું પરંતુ આ વખતે સેફ્ટ ડ્રાઈવ જવાનું નક્કી કર્યું. સવારે ૬ કલાકે શરૂ થઈ અમારી SOU ની યાત્રા. વચ્ચે બ્રેક લેતા અને બપોરે ૪ કલાકે પહોંચી ગયા કેવડીયા. કેવડીયા એટલે સરદાર પટેલનું ૧૮૨ મીટર લાંબુ સ્ટેચ્યુનું જ્યાં છે તેની બાજુનું ગામ. સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં બન્યું છે તે ગામનું નામ સરદાર ગામ છે આ ગામના સન્માન માટે આપવામાં આવ્યું છે “એકતાનગર”.

પહેલા દિવસે સવારથી ડ્રાઈવ કરી હોવાના કારણે અમે હોટલમાં જ રહી આરામ કરવાનું પસંદ કર્યું. પણ હા અમે એ દિવસે નર્મદા આરતી કરી હોય તો સાચું થાત તેમને ચોક્કસ લાગ્યું. એકતા નગરમાં અમે જોવા હોય તેવા સ્થળની વાત કરીએ

૧. સ્ટેચ્યુ ઓફ યુનિટી
એકતા નગરમાં સૌથી મહત્વનું જોવાનું સ્થળ છે SOU. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગ્રહ ભૂમી સરદાર વલ્લભભાઈ પટેલની જાજરમા ૧૮૨ ફીટ ઊંચી પ્રતિમા. આ પ્રતિમાને બહારથી જોઈ કોઈ પણ આતિમાન થઈ જાય તે ચોક્કસ છે. SOU માં પ્રવેશતા સાથે જ તમને ત્યાં બનાવવામાં આવેલ ઉત્તમ “વૅલ્યુ સેશન” ગમી જશે. આ ઉપરાંત ત્યાં પર્ફેક્ટ માટે આવામાં આવેલ વ્યવસ્થા માટે પણ માન થશે તે ચોક્કસ છે. કોઈ વ્યક્તિ એન્ટ્રીથી પળપળા પછા સ્ટેચ્યુ સુધી જઈ શકે છે અને તમને તડકાથી બચાવવા

એક્સપ્રેસ એન્ટ્રીનો વિકલ્પ પણ રહે છે. આ એક્સપ્રેસ એન્ટ્રી વડે તમે કોઈ લાઈનમાં ઊભા રહ્યા વિના આગળ વધી શકો છો. આ એક્સપ્રેસ ટિકિટનો આવતા વર્કસ છે અને એટલા પાડવા માટે પણ આ જગ્યા સારી છે.

૨. સરદાર સરોવર કેમ સાઈડ એન્ડ લાઈટ શો

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર થતો સાઈડ એન્ડ લાઈટ શો જોઈ અમે આગળ વધ્યા સરદાર સરોવર ઉપર લાઈટ એન્ડ સાઈડ શો જોવા. અંદાજે ૧.૫ કલાક સુધી જાય ત્યાં સરદાર સરોવર ઉપર સાઈડ એન્ડ લાઈટ શો જોવાની જોઈ શકાય છે. ત્યારબાદ લીટર લામ થતો હોતો નથી.

૧૮૨ મીટર ઊંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમાનો “વ્યૂઈંગ ગેલેરી” ૧૫૩ મીટર ઊંચી આવેલ છે. આ ૧૫૩ મીટર ઉપર ગેલેરીમાં ઊભા રહી તમે સરદાર સરોવર ઉપર તમા નર્મદા નદીનો આકાશ નજારો જોઈ શકો છો.

સ્ટેચ્યુને જોવા માટે અલગ અલગ સ્લોટમાં ટિકિટ બુક કરવાની રહે છે. આ સ્લોટ ૨ કલાકના રહેતા હોય છે. મારા વ્યક્તિગત મને શક્ય હોય તો મારા સ્લોટ પેડી સાંજે ૪ થી ૬ નો સ્લોટ પસંદ કરવો સારો રહે. આ અંગેનું કારણ એ છે કે સાંજે ૭.૩૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે “સાઈડ એન્ડ લાઈટ શો” રહેતો હોય છે. “ટેન્ડોવોલિંગ” અને “ડિઝિટી” નો સમન્વય એટલે આ શો સરદાર પટેલની જીવન વિવિધ સાઈડ એન્ડ લાઈટ દ્વારા અત્યંત રીતે રજૂ કરવામાં આવેલ છે. આ શો જોવાનું પણ યુવા જનુ નથી. આ શો જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બહારના ભાગમાં પણ બેન્ચ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ત્યાંથી થોડા દૂર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પણ આ શો માણી શકીએ તેવી બેન્ચ વ્યવસ્થા

એક ફલાવર્સ આવેલ છે. આ વેલી એક ફલાવર્સમાં ખૂબ સરસ રીતે વિવિધ પ્રકારના ફૂલો આપે જોઈ શકો છો. આ ગાર્ડનમાં દિવસ દરમિયાન પ્રવાસીઓ આવતા હોય છે અને એટલા પાડવા માટે પણ આ જગ્યા સારી છે.

સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી આ ગાર્ડન ખુલ્લો હોય છે. આ ગાર્ડનમાં દિવસ દરમિયાન પ્રવાસીઓ આવતા હોય છે અને એટલા પાડવા માટે પણ આ જગ્યા સારી છે.

સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી આ ગાર્ડન ખુલ્લો હોય છે. આ ગાર્ડનમાં દિવસ દરમિયાન પ્રવાસીઓ આવતા હોય છે અને એટલા પાડવા માટે પણ આ જગ્યા સારી છે.

૩. રાજા ગાંધી
એકતાનગરની આ પણ એક જોવા જેવું વિશિષ્ટ સ્થળ છે. વિશિષ્ટ પ્રકારની કબીર લાઈટ દ્વારા આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. આ ગાર્ડન પણ પર્ફેક્ટ ચોક્કસ માણવું જોઈએ. ગ્લો

એકતા નગરને પવિત્ર નર્મદા નદી ઉપર સ્થિત છે. અહિંયાં આવીએ ત્યારે આ નર્મદા આરતીનો લાહવો લેવાનું ચુકવું નહીં. રાત્રે ૮ કલાકે મતી આ આરતી પણ અંદાજે ૩૦ મિનિટ જેવું હોય છે. અમે આ આરતીનો લાહવો લીધો. ખરેખર વાતાવરણમાં પવિત્રતા પ્રવાસીને અનુભવ થશે તે વાત ચોક્કસ છે. આ આરતી સ્થળે એન્ટ્રી માટે કોઈ ટિકિટ નથી. આરતીના ચરમાન બનવું હોય તો તેના માટે ૧૧૦૦/- ની રકમ આપવાની રહેતી હોય છે.

૪. એકતા ફૂડ કોર્ટ

એકતા ફૂડ કોર્ટે અહિંયાંનું ઓફિશિયલ “ફૂડ ગ્રોન” છે. આ ફૂડ ગ્રોનમાં વિવિધ બ્રાઉન ફૂડ રેસ્ટોન સ્ટોલ જોવા મળશે. આમાં, સમ વે, અમુલ ગ્વાલિયા જેવી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અહીં બેકેક વ્યવસ્થા વચ્ચે પ્રવાસીઓ ભોજનની સ્વાદ માણી શકે છે. હા, પ્રમાણમાં અહિંયાં ફૂડ મોંઘું છે તેવો મારો મત છે. એકતા ફૂડ કોર્ટે એ એકતા નગર પાર્કિંગના સામેના ભાગમાં આવેલ છે.

૫. એકતા મોલ
એકતા મોલ એ એકતા નગરનો આધિકારિક શોપિંગ મોલ છે જ્યાં તમને દેશના વિવિધ રાજ્યોની જાણીતી વસ્તુઓ પહોંચવાની મેડ મળે છે સરદાર પટેલ સાહેબના મેડેમોમાં હાઈ શક્તિ પેલી વિવિધ વસ્તુઓ પણ અહીં મળે છે. આ મોલ સવારે અંદાજે ૧૧ કલાકથી રાત્રિના ૮ કલાક સુધી ખુલ્લો રહેતો હોય છે. આ મોલ એકતા નગર પાર્કિંગના સામેના ભાગમાં આવેલ છે.

૬. સ્વામિનારાયણ ધામ પોર્ટીયા

એકતા નગરથી અંદાજે ૪૫ કિલોમીટર દૂર આવેલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિકસિત કરવામાં આવેલ

જાન ના હતું મને અમે આ રાત્રિ રોજાણથી વિચિત રહ્યા હતા.

અમે અમારા પ્રવાસ દરમિયાન ઉપરના સ્થળો જ માણી શક્યા હતા. આ સિવાય પણ ઘણા સ્થળો છે જે પ્રવાસીઓ માણી શકે છે. અમે જોયેલા ઉપરોક્ત સ્થળ ઉપરાંત એકતાનગરમાં હાઈ-સ્પીડ બોટ નો લાહવો લઈ શકાય છે જે શ્રેષ્ઠ ભાસ્ત ભવનથી SOU સુધી ૧૫ મિનિટની સ્પીડ બોટ રાઈડ







કરવે છે. જેની ટિકિટ વર્કસ અને બાળકો માટે ૫૩૨ રૂ છે અને જેનો સમય સવારે ૧૧ થી ૫ નો છે. આ ઉપરાંત એકતા ફૂડ છે જે શ્રેષ્ઠ ભાસ્ત ભવનથી SOU સુધીનો પ્રવાસ ધીમી ગતિએ કરાવે છે અને નર્મદા નદી અને આસપાસના સુંદર નજારો જોવાની તક પ્રવાસીઓને આપે છે. આ ફૂડનો સમય સવારે ૮ થી ૫ સુધીનો રહેતો હોય છે. આ ફૂડમાં એક સમય ૪૦ મિનિટનો રહેતો હોય છે અને આની ટિકિટ વર્કસ માટે ૪૧૩ રૂ અને બાળકો માટે ૨૦૭ રૂ છે. આ ઉપરાંત રાત્રિના આ ફૂડ એ એકતા ડિનર ફૂડ તરીકે ઓળખાય છે અને ડિનર સાથે રાત્રિના સમયે નર્મદા

ખૂબ સંતોષ થાય. બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે હું આ જગ્યાને ઉત્તમ વિકલ્પ માનું છું.

SOU દુર અંગે મારા સૂચન
મારા મતે SOU જવાનો પ્લાન કરવામાં આવે તો ઓછામાં ઓછું બે દિવસ અને સારી અને સંપૂર્ણ પૂર્ણ આ સ્થળને ફરવું હોય તો ત્રણ દિવસનો પ્રવાસ પ્લાન કરવો જોઈએ. આ ત્રણ દિવસમાં સોમવાર કે રજાનો દિવસ ના લેવો જોઈએ. બે થી અઢી દિવસમાં એકતા નગરના લગભગ તમામ સ્થળો વ્યવસ્થિત રીતે માણી શકાય છે. તો ત્રીજા દિવસે એ પોર્ટીયા સ્વામિનારાયણ ધામ ખાતે કરવાનો વિકલ્પ રહેશે. રહે પોર્ટીયા પહોંચી ત્યાં પ્રવેશન નિહાળી આરતીનો લામ લઈ શકાય છે આ ઉપરાંત સવારે સૂર્યોદય થતી આરતીનો લામ લઈ આવ પોતાનો પ્રવાસ પૂર્ણ કરી શકો છો.

“ઓરટ ઇમ્પોર્ટેટ ફેટ”
દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની સાથે એકતા નગરના તમામ જોવા લાયક સ્થળો બંધ રહેતા હોય છે. ક્યારેક સોમવારે જો રજાનો દિવસ હોય તો પ્રવાસીને લામ આપવા



હોટેલ અને રેસ્ટોરન્ટ પર જી.એસ.ટી. કેવી રીતે લાગે???

		
ADV. KAMEISHA THIRUVEI Senior Vice President	CA. ANITHA DOGGAI Hon. Secretary	CA. DJU VIGNESH SHARI Immediate Past President
		
ADV. MURUGESA NALL Vice President (Chennai District Zone)	ADV. SURESH SHARI Vice President (Chennai Zone)	ADV. MANENDRA JAYAKI Vice President (Thiru. Zone)
		
CA. SANJEEV BODDI Vice President (Guaranteed Zone)	CA. NITESH MOHA Vice President (South Zone)	ADV. PRASANT SHARI Hon. Treasurer
		
ADV. ANANT KUMAR Hon. J. Secretary	ADV. SURESH SANKRISHNA Hon. J. Secretary	ADV. SANKAR SHARI Hon. J. Secretary

**એજીએફટીસીના વર્ષ
૨૫-૨૬ના હોદ્દાઓ નિમાયા**

ALL GUJARAT FEDERATION OF TAX CONSULTANTS
 Floor No. 103-B wing, Pragatishree Nee Bhawan, Ne. Paragumbe, Ahmedabad.
 Ahmedabad - 380 015, Gujarat, India. Email: info@agftc.org

MANAGING COMMITTEE FOR THE ACTIVITY YEAR 2025-26

OFFICE BEARERS

		
CA KISHOR SHAH President Emeritus	ADR ASHUTOSH THAKUR President	
		
ADR KANESH THAKUR Senior Vice President	CA ANITA DODIA Hon. Secretary	CA D. GUNDESH SHAH Immediate Past President
		
ADR MADHUKAR VAGEL Vice President (Gandhinagar Zone)	ADR SURESH SHAH Vice President (Central Zone)	ADR KHANDESH SHAH Vice President (East Zone)
		
CA SANJEEV BISHDI Vice President (Gandhinagar Zone)	CA NITESH MEHR Vice President (South Zone)	ADR PHULSHI SHAH Hon. Treasurer
		
ADR ANKIT SONI Hon. Jt. Secretary	ADR SURESH DARGHOLLA Hon. Jt. Secretary	CA TANISHK SONI Hon. Jt. Secretary

સવાલ આપના જવાબ 'ટેક્સ ટુડે' એક્સપર્ટના

Goods Services Tax

અમારા અસીલ દ્વારા ૨૦૨૨માં ધંધો શરૂ કરી જી.એસ.ટી. નંબર લેવામાં આવેલ હતો. હવે ૨૦૨૫ માં તેઓએ જી.એસ.ટી. નંબર કેન્સલ કરાવ્યો છે. જી.એસ.ટી. નંબર રદ થવા સમયે સ્ટોકમાં રહેલ માલ સંદર્ભે તથા કેપિટલ ગુડ્સ સંદર્ભે ભરવામાં આવેલ છે. શું આમ છતાં કેપિટલ ગુડ્સ ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ (૫ વર્ષની મર્યાદામાં) રિવર્સ કરવી જરૂરી બને?

— જે.વી. પટેલ એન્ડ કું, જેતપુર

જવાબ: ના, કલમ ૨૮(૫) હેઠળ કરદાતાએ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કે આઉટપુટ ટેક્સ બે માંથી જે વધુ હોય તે ભરવાપાત્ર બને. આમ, જો આપના અસીલ દ્વારા કેપિટલ ગુડ્સ ઉપર ભરવામાં આવેલ આઉટપુટ ટેક્સ તે રિવર્સ કરવા પાત્ર ક્રેડિટ થી વધુ હોય તો આપના અસીલની કેપિટલ ગુડ્સ ઉપર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

Income Tax

અમારા અસીલ અત્યાર સુધી ધંધાકીય આવક હોવાથી ITR 4 ફાઇલ કરતાં હતા. હવે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કેપિટલ ગેઈન પણ સાથે હોય તેથી ITR 3 ભરવાપાત્ર બનશે. શું ITR 3 ભરવાના કારણે તેઓએ ધંધાકીય ચોપડા ફરજિયાત બનાવવા જરૂરી બને?

—નિમેશ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: ના, ઈન્કમ ટેક્સ હેઠળ ધંધાકીય ચોપડા બનાવવા પડે કે નહીં તે ધંધાકીય આવક કેવી અને કેટલી છે તેના ઉપર નિર્ભર રહે નહીં કે ક્યાં ITR ભરવાપાત્ર છે તેના ઉપર. આપના અસીલ અંદાજિત આવક ચોપડા (પ્રિસમંદિવ ટેક્સેશન) દર્શાવી ધંધાકીય આવક દર્શાવતા હોય તો ITR 3 ભરવું હોવા છતાં તેઓ ચોપડા નિભાવવા જવાબદાર બને નહીં તેવો અમારો મત છે.

DI. 07.06.2025

Goods Services Tax

અમારા અસીલ હોપિટલ ચલાવે છે. તેઓ ભાડેથી હોસ્પિટલ બિલ્ડિંગ લીધેલ છે. શું અમારા અસીલ આ ભાડાની ચુકવણી ઉપર RCM ભરવા જવાબદાર બને?

—સુદેશી કોલીપાર, પોતુર

જવાબ: હા, આપના અસીલ કોમર્સિયલ મિલ્કત ભાડે છે જે એટલે ભાડાની ચુકવણી જો બિન નોંધાયેલ વ્યક્તિને કરવામાં આવતી હોય તો આપના અસીલ RCM ભરવા જવાબદાર બને તેવો અમારો મત છે.



અમારા અસીલે BU આવ્યા પહેલા એક થર્ડ બુક કરાવ્યું છે. આ ધરની દસ્તાવેજની રકમ ૫૦ લાખ જેવી છે. હાલ, બુકિંગ સમયે જે ૨ લાખની રકમ આપી તેના ઉપર ૫% જી.એસ.ટી. ચુકવવામાં આવેલ છે. હવે જ્યારે આગામી મહિનામાં બિલ્ડર ઈન મેગ્નેટી લેશે ત્યારબાદ ચુકવવાની થતી રકમ ઉપર શું જી.એસ.ટી. લાગુ પડે?

ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણપત્રા, જેતપુર
CA દિવ્યેશ સોહા, પોરબંદર
એડવોકેટ ભૂવેષ પોપટ

—પ્રવીણભાઈ ખરેયા, અમદાવાદ

જવાબ: હા, એક વાર BU આવ્યા બાદ ત્યારે થર માટે બુકિંગ કરાવેલ હોય તેવા સંજોગોમાં BU આવ્યા બાદ કરવામાં આવેલ ચુકવણી ઉપર પણ જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે.

અમારા અસીલ મે ૨૦૨૫ થી GST R1માં HSN માટે B2B HSN અને B2C HSN બે અલગ વિકલ્પ આપવામાં આવ્યા છે. પરંતુ માફી માલ અને Non GST Sales માટે HSNનો કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી. તો આવા વેપારીઓને જાણ કરવા દર્શાવવાના રહે.

—જગદીશ વ્યાસ, ટેક્સ એડવોકેટ, હિસા

જવાબ: આ વેચાણ HSN B2C માં બતાવવાના રહે તેવો અમારો મત છે.

અમારા અસીલ હોસ્પિટલ-હેલ્થ કેર સેવા પૂરી પાડે છે. તેઓની સેવાઓ કસ્ટમર છે. શું તેઓએ જી.એસ.ટી. રજીસ્ટ્રેશન લેવું ફરજિયાત બને?

—સુદેશી કોલીપાર, પોતુર

જવાબ: આપના અસીલ જો માત્ર હેલ્થ કેર સેવા પૂરી પાડતા હોય તો જી.એસ.ટી. રજીસ્ટ્રેશન લેવાની જરૂર રહેતી નથી. પરંતુ સાથે તેઓ જો બાકી પડે કે અન્ય સેવાઓ લેવા જવાબદાર બને તેવો અમારો મત છે.

મે ૨૦૨૫ના રિટર્નથી B2CLના HSN B2Bમાં કે B2Cમાં એમ ક્યાં દર્શાવવાના રહે?

—જગદીશ વ્યાસ, ટેક્સ એડવોકેટ, હિસા

જવાબ: આ વેચાણની રકમ પણ B2Cના વિકલ્પમાંજ દર્શાવવાના રહે તેવો અમારો મત છે.

Income Tax

અમારા અસીલ માલ વેચનાર છે. તેઓને વેચાણ બદલનો અવેજ ૨ લાખ ઉપર રોકડમાં મળે છે. શું તેઓ આ રકમ રોકડમાં સ્વીકારી શકે?

—સુદેશી કોલીપાર, પોતુર

જવાબ: ઈન્કમ ટેક્સની કલમ 269ST મુજબ કોઈ વેચનાર કોઈ પણ

સંજોગોમાં વેચાણ અવેજની રકમ ૨ લાખ કે તેથી વધુ રોકડમાં લઈ શકે નહીં તેવો અમારો મત છે.

અમારા અસીલના નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ નું ઈન્કમ ટેક્સ રિટર્ન ૦૧.૦૭.૨૦૨૪ ના રોજ ફાઇલ કરેલ છે. હજુ આ રિટર્નનું સ્ટેટસ અડડ પ્રોસેસ બતાવે છે. આ રિટર્ન પ્રોસેસ કરવા અંગે અમોએ ૧૫ જેટલી કોમ્પ્લેન કરેલ છે. જેમાં CPC દ્વારા આ રિટર્ન અમુક વેલિફિકેશન પછી પ્રોસેસ થશે તેવું જણાવેલ છે. આ રિટર્નમાં અમોએ ૫ લાખ જેવું ફિક્સ કલેઈમ કરેલ છે. આ અંગે અમો શું કરી શકીએ?

—મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: તમે ફાઇલ કરેલ રિટર્ન બાબતે તમે ગ્રીવન્સ દ્વારા વાસ્તવ વિનંતી કરેલ છે. હવે તમે આ બાબતે જે તે હાર્ડફેક્ટમાં ફિટ વિનિર્દેશ દાખલ કરવાનો વિકલ્પ રહે છે. આ રિટર્નમાં ક્રેડિટ પાસે આ રિટર્નનો ખર્ચ આપવા પણ દાદ માંગી શકાય છે.

—: ખાસ નોંધ :-

૧. જી.એસ.ટી.ની જોગવાઈઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે જાણવાતા હોય તે બાબત ખૂબ સાચી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ અકાઉન્ટીંગમાં ઉપરિચિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાર્યદાના નિમ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.

૨. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ શકાય છે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર થણા પરિમિતો પર નિર્ભર કરવો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એકાઉન્ટન્ટ્સ ડ્રિલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

૩. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભથી આપે છે તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઈ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક નિમિત્તવચસાવી રીતે ના કરવો.

આ કોલમ અતંતરત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayunag@gmail.com પર ઈ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

રિસ્કલેસ: આ કોલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા રાશ્ય તત્ત્વમ કાળજી રાખી કાપડા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત ખર્ચાઓ ઉપર આધારિત છે.


ઈન્કમ ટેક્સ હેઠળ AIS તથા TIS કરદાતા માટે છે ઉપયોગી કે આફ્ટરપૂર્વ??

ઈન્કમ ટેક્સ હેઠળ કરદાતાની આવક તથા આર્થિક વ્યવહારોની માહિતી દર્શાવે છે AIS તથા TIS AIS/TISની માહિતી મોડી દર્શાવવામાં આવતી હોય આ વર્ષે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત ૧૫ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી



By Bhavya Popat, Advocate

ઈન્કમ ટેક્સ હેઠળ રિટર્ન ભરવાની પદ્ધતિમાં તથા તેને લગતા નિયમોમાં સતત ફેરફાર થતાં રહેતા હોય છે. આ પદ્ધતિમાં છેલ્લા ત્રણ વર્ષથી આવક રીપોર્ટનું નામ જુદું છે. ઈન્કમ ટેક્સ પોર્ટલ ઉપર કરદાતા પોતાના આર્થિક વ્યવહારોની માહિતી એન્યુઅલ ઈન્કોમેક્સ રેટરમેન્ટ એટલેકે AIS તથા ટેક્સ પેયર્સ ઈન્કોમેક્સ સર્વિસ એટલેકે TIS જાઉં શકે છે. AIS કરદાતાને તેઓના તમામ મોટા વ્યવહારોની વિગતો મળે છે જ્યારે TIS હેઠળ કરદાતાને પોતાની આવક સંબંધી મહત્વની માહિતી મળી રહેતી હોય છે. આ AIS તથા TIS એ અન્ય કરદાતાઓ દ્વારા જે તે સરકારી તથા ખાનગી એજન્સી દ્વારા આપવામાં આવતી વિગતો તથા અન્ય કરદાતા સાથેના વ્યવહારોની આપવામાં આવતી વિગતો ઉપરથી તૈયાર કરવામાં આવતું હોય છે.



શું છે AIS તથા TIS?

સામાન્ય ભાષામાં તાર કરીએ તો AIS એક એવું પત્રક છે જે ખંડમાં કરદાતા દ્વારા સરકારી વિભાગ નાણાકીય વ્યવહારોની માહિતી વ્યક્તિઓ પાસેથી મળેલ માહિતીની વિગતો હોય છે. આ વિગતોમાં કરદાતા દ્વારા બેન્કમાં કરવામાં આવેલ રોકડ-જમા ઉપર, મોટી વિલંબની ખરીદી-વેચાણ, કોઈ એક ઈન્કમ-કે-વેપારી પાસેથી આવક મળેલ મોટી ખરીદીઓ, રોકા બજારના મોટા વ્યવહાર જેવી વિગતોનો સમાવેશ થાય છે. આ વિગતો ઉપરથી કરદાતાને ઈન્કમ ટેક્સ ભરવામાં ઉપયોગી માહિતી સંક્રમિત સ્વરૂપમાં TISમાં આપવામાં આવે છે. કરદાતા

ઉપયોગી સાબિત થતી હોય છે. પરંતુ જો કોઈ કરદાતા આ વિગતોને ધ્યાને લીધા સિવાય પોતાનું રિટર્ન ગાંઠેલ રહીને ભરવામાં આવે તો AIS તથા TIS ની માહિતી તેના માટે આફ્ટરપૂર્વ પણ બની શકે છે.

AIS કે TIS ધ્યાને લીધા સિવાય ભરવામાં આવેલ રિટર્ન રિવાઈઝ કરી શકાય છે!!

૩૧ જુલાઈ સુધીમાં સામાન્ય રીતે ઓફિસ લાગુ ના પડતું હોય તેવા કરદાતાઓ એ પોતાના રિટર્ન ભરી કરદાતાઓ હોય છે જો કે આ વર્ષે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત ૧૫ સપ્ટેમ્બર સુધી વધારી કરવામાં આવેલ છે. પણ કરદાતા એવા છે કે જેઓએ AIS તથા TISને ધ્યાને લીધા સિવાય પોતાના ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી આપ્યા છે. આવા કરદાતાઓમાં મોટાભાગે એવા કરદાતાઓનો સમાવેશ થાય છે કે જેઓ પોતાનું ઈન્કમ ટેક્સ રિટર્ન જાહેર, કોઈ તથા TISની માહિતી ઈન્કમ ટેક્સ પોર્ટલ ઉપર મારિટ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ હોય છે. ક્યારે એવી શક્યતા પણ રહેતી હોય છે કે આ માહિતી આપવામાં કોઈ ભૂલ થયેલ હોય. જ્યારે AIS કે TIS ની માહિતી સાચી ના હોય તેવા સંજોગોમાં કરદાતાએ આ પોર્ટલ માહિતી અંગે ઈન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ફિક્સેડ આપવો જરૂરી છે. આ ફિક્સેડમાં કરદાતા દર્શાવી શકે છે કે AIS કે TISમાં તેમના PAN ઉપર દર્શાવવામાં આવેલ માહિતી તેઓની નથી. ભરતા જણાવતા છે કે આ માહિતી ક્યાં PAN (કરદાતા) ને લખતી છે તો તે અંગે તે PAN દર્શાવી ફિક્સેડ આપી શકે છે. આ માહિતી જ આ વર્ષમાં દર્શાવવામાં આવેલ હોય તે સિવાયની હોય તો પણ કરદાતા આ અંગે વર્ષ બાબતે ફિક્સેડ આપી શકે છે. આ માહિતી અધિકૃત કે સંપૂર્ણપણે સાચી ના હોય કે સંપૂર્ણપણે માહિતી મોટી હોય તો પણ કરદાતા આ ફિક્સેડ આપી આ માહિતીનો અસ્વીકાર કરી શકે છે.

ઈન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ૦૧ નવેમ્બર ૨૦૨૪ થી શરૂ કરવામાં આવેલ AIS તથા TISની સવય કરદાતા માટે આ કારણે કંપ્લેક્સકારક જ ગણી શકાય. પોતાના ઈન્કમ ટેક્સ રિટર્નમાં કોઈ માહિતી ભરી જરૂરી છે તેનો અંદાજ તેઓને આવી જોય હોય છે. આ ઉપરાંત AIS-TISના કારણે ક્યારેક ભરત ચુકવી કોઈ આવક કે વ્યવહાર દર્શાવવામાં ચુક થયેલ હોય તો પણ આ માહિતી ઉપરથી કરદાતા આ આવક કે વ્યવહાર યોગ્ય રીતે દર્શાવી શકે છે. આમ, કરદાતા દ્વારા AIS તથા TISમાં દર્શાવવામાં આવેલ માહિતીનો ઉપયોગ કરી ભારે તે જરૂરી છે. AIS/TISની વિગતો સામાન્ય રીતે ૩૧ મે પછી જ દર્શાવવાની શરૂ થતી હોય છે અને આ કારણે જ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત ૧૫ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવેલ છે.

AIS અથવા TISમાં દર્શાવવામાં આવેલ માહિતી સાચી ના હોય તો કરદાતા પાસે શું છે વિકલ્પ??
ઉપર જણાવેલ છે તેમ AIS

જી.એસ.ટી. હેઠળ બ્લોક કેડિટસ એટલે શું??? આ કેડિટ વેપારીઓને મળી શકે નહીં વેપારીઓ દ્વારા આ કેડિટ લેવાની અજાણતા થઈ જતી હોય છે ભૂલ. ભવિષ્યમાં વ્યાજ અને દંડની મોટી જવાબદારી ઊભી થઈ શકે છે!!

-By Bhavya Popat, Advocate Notary

તા. ૨૬.૦૫.૨૦૨૫

ગુડ્સ અને સર્વિસીસ ટેક્સ લેવાનો મુખ્ય હેતુ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો “સીમલેસ કલો” મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. જો કે, જી.એસ.ટી. કાયદા હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા અંગે અમુક ચોક્કસ નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યા છે. કરદાતાએ પોતાની માલ અને સેવાઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આ નિયંત્રણોને આધીન લેવાની હોય છે. નીચે શરૂઆતમાં કહીએ તો જી.એસ.ટી. કાયદા હેઠળ અમુક ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા ઉપર મનાઈ ફરમાવવામાં આવેલ છે જેને ટેકનિકલ ભાષામાં “બ્લોક કેડિટસ” તરીકે ઓળખવામાં આવે છે. આ “બ્લોક કેડિટસ” ભલે થંધા અનુસંધાને વાપરવામાં આવેલ હોય, આમ છતાં આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કોઈ કરદાતાને મળવા પાત્ર થશે નહીં.

આ બ્લોક કેડિટસની યાદી જી.એસ.ટી. કાયદા ૨૦૧૭ની કલમ ૧૭(૫) હેઠળ આપવામાં આવેલ છે. બ્લોક કેડિટની શ્રેણીઓ નીચે મુજબ છે—

- વ્યક્તિઓના પરિવહન માટેના મોટર વીહીકલ (મોટર કાર, સ્કૂટર વી.) અને તેને લગતા લીમા, સર્વિસિંગ, સમારકામ અને જાળવણી માટેની સેવાઓ. (જ હાજો અને વિમાન સહિત) (કલમ ૧૭(૫)(a),(aa), (ab))
- ખોરાક અને પીણા (રેસ્ટોરન્ટ સેવા), આઉટડોર કેટરિંગ, સર્વિસ સપ્લાયર (બ્યુટી ટ્રીટમેન્ટ), આરોગ્ય સેવાઓ વગેરે (કલમ ૧૭(૫)(b))
- કલ્પ, આરોગ્ય અને ફિટનેસ સેન્ટરનું સમ્પત્તિ; (કલમ ૧૭(૫)(b))
- કમ્પ્યુટરીઓને રજા પર મુસાફરી લાભો જેમ કે રજા અથવા થર મુસાફરી કન્સેશન (કલમ ૧૭(૫)(b))
- “વર્કડ કોન્ટ્રાક્ટ” ની સેવાઓ જ્યારે તે સ્થાવર મિલકત સંદર્ભે લેવામાં આવેલ હોય (કલમ ૧૭(૫)(c))
- સ્થાવર મિલકતના બાંધકામ માટે મળતી મળતી મળતી (પ્લાન્ટ અને મશીનરી સિવાય) (કલમ ૧૭(૫)(d))
- જે માલ અથવા સેવાઓ અથવા બંને પર કલમ ૧૦ હેઠળ થર ચુકવવામાં આવેલ હોય; (કલમ ૧૭(૫)(C))
- બિન-નિયમીત સ્થાવર વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થતી વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને, તેના દ્વારા આપતા કરાવેલ માલ સિવાય (કલમ ૧૭(૫)(એક))
- કારખાતે વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થતી વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને, જેનો ઉપયોગ કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૩૫ માં ઉલ્લેખિત કોર્પોરેટ સમાજિક જવાબદારી હેઠળ તેની જવાબદારીઓ સંબંધિત પ્રવૃત્તિઓ માટે થાય છે અથવા તેનો ઉપયોગ કરવાનો હેતુ છે (કલમ ૧૭(૫)(એક))
- વ્યક્તિગત વપરાશ માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને (કલમ ૧૭(૫)(જ))
- બેટ અથવા મદત નમૂનાઓ દ્વારા ખોવાયેલી, ચોરાયેલી, નાશ પામેલી, લાગણી અથવા નિકાસ કરાયેલી વસ્તુઓ (કલમ ૧૭(૫)(એક))
- નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ સુધીના કોઈપણ સમયગાળાના સંદર્ભમાં કલમ ૭૩ ની જોગવાઈઓ અનુસાર ચુકવવામાં આવેલ કોઈપણ કર

Blocked ITC under GST



(કલમ ૧૭(૫)(આઈ))
વેપારીઓ દ્વારા થતી હોય છે આ સામાન્ય ભૂલો

જી.એસ.ટી. કાયદામાં ઉપર જણાવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક હોવા છતાં વેપારીઓ દ્વારા આ પ્રકારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કલ્પને આ નિયમથી અજાણતા તો ક્યારેક જાણી જોઈને આ ક્રેડિટ લેવામાં આવતી હોય છે. ખાસ કરીને થણા વેપારીઓ પોતાના દ્વારા ખરીદવામાં આવતી મોટર કાર, બાઈક તેના પરના ઈન્સ્યુરન્સ, સર્વિસ ખર્ચ વગેરેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કલેઈમ કરતાં હોય છે. આવી જ રીતે ક્યારેક થણા વેપારીઓ પોતાના ફેબ્રિકા સાથે અથવા બિઝનેસ મિટિંગ માટે થયેલ રેસ્ટોરન્ટ ખર્ચની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ માંગી લેતા હોય છે. આ ઉપરાંત અમુક વેપારીઓ પોતાના દ્વારા હાથ ધરવામાં આવેલ બ્યુટી ટ્રીટમેન્ટ ખર્ચ ઉપર ચુકવવામાં આવેલ જી.એસ.ટી. પણ ક્રેડિટ તરીકે માલ માંગી લેતા હોય છે. જી.એસ.ટી.આર. ઊંડા ના “કોલમ” જોતાં, આ પ્રકારની ક્રેડિટ કલેઈમ ક્રેડિટનો ભાગ હોય સામાન્ય રીતે જી.એસ.ટી. રિટર્ન ફાઇલ કરનાર ટેક્સ એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેક્સ પ્રોફેશનલ્સ જેવા ટેક્સ પ્રોફેશનલ્સને ધ્યાને આવવું થાય હોતું નથી. આમ, ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા અજાણતા જ આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો કલેઈમ પોતાના અસીલો માં થઈ જતો હોય છે. આ તકે આ બાબત દરેક વેપારીએ અને એકાઉન્ટન્ટ દ્વારા સમજણી હાથ જરૂરી છે કે ઉપર જણાવેલ બ્લોક કેડિટ કોઈ પણ સંજોગોમાં મળે નહીં. હા, કાર કે બાઈકના ઈન્પુટ ટેક્સ હોય અને ખરીદેલ વેચાણ સંદર્ભે જે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેમણે મળે તે બ્લોક કેડિટમાં આવે નહીં. પરંતુ સામાન્ય વેપારીઓ માટે ઉપર જણાવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં.

સામાન્ય ભૂલની અસામાન્ય જવાબદારી!!!

સામાન્ય રીતે વેપારીઓ એવું માનતા હોય છે કે ટેક્સ ઈવોલ્યુશનમાં GST નેવર દર્શાવવામાં આવે, GST 2B માં નહીં રકમ ફિલ્લ થતી હોય તેવી તમામ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓ કલેઈમ કરી શકે. પરંતુ આ એક ભૂલ ભરેલી માન્યતા છે. ઉપર જણાવેલ “બ્લોક કેડિટ”માં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ સમાવનાર કોઈ વેપારી કલેઈમ કરી શકે નહીં. આ પ્રકારની ક્રેડિટ કલેઈમ કરવામાં આવેલ હોય અને જી.એસ.ટી. ઈન્પાઈડમેન્ટ દ્વારા આ પડકાર પોતામાં આવે ત્યારે વેપારી ઉપર ગંભીર અસર જવાબદારીની જતી હોય છે. આવા સંજોગોમાં વેપારી ૧૮% લેવેલ અથવા ભરવા જવાબદાર બની જતાં હોય છે. આ ઉપરાંત ટેક્સની રકમ જેટલો દંડ ભરવાની જવાબદારી પણ અમુક કિસ્સાઓમાં આવી જતી હોય છે. આમ, વેપારીની દ્રષ્ટિએ સામાન્ય લાગતી ભૂલ તેઓને મોટી આર્થિક જવાબદારી સ્વરૂપે સમજ થઈ શકે છે. આ તક જરૂરી છે કે વેપારીઓ આ બાબત સમજે અને આ પ્રકારની બ્લોક કેડિટ લેવાની દૂર રહે.